

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ

પર્યાવરણ ભવન

સેક્ટર નં. ૧૦- અ, ગાંધીનગર

ફોન નં. (૦૭૯) - ૨૩૨૪૫૧૫૮

(જાહેરાત ક્રમાંક : ગુપ્રનિબોર્ડ/વર્ગ - ૨ અને ૩/૨૦૧૭/૧)

(વેબ સાઈટ એડ્રેસ : <https://ojas.gujarat.gov.in> ) બોર્ડ વેબ સાઈટ એડ્રેસ : ([www.gpcb.gov.in](http://www.gpcb.gov.in) )

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા વર્ગ- ૨ અને ૩ સંવર્ગની નીચેની જગ્યાઓ પર ઉમેદવાર પસંદ કરવા માટે ઓન લાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે <https://ojas.gujarat.gov.in> વેબ સાઈટ પર તારીખ : ૧૬/૧૦/૨૦૧૭ (૧૩.૦૦ કલાક) થી તા.૧૦/૧૧/૨૦૧૭ (૧૩.૦૦ કલાક) દરમિયાન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, વિશેષ લાયકાત,અનુભવ, વય અને વયમર્યાદામાં છુટછાટ, પરીક્ષા પદ્ધતિની વિગતો, ઓન લાઈન અરજી કરવાની પદ્ધતિ, પરીક્ષા ફી, વગેરે અંગેની અરજી કરવાને લગતી સંપૂર્ણ સુચનાઓ સદર વેબ સાઈટ પર મુકવામાં આવેલ છે. રસ ધરાવતા ઉમેદવારોએ તમામ વિગતો ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કર્યા બાદ જરૂરીયાત મુજબના પ્રમાણપત્રો/માર્કશીટ, અનુભવના નિયુક્તિપત્રો, અનુભવના પ્રમાણપત્રો પોતાની સાથે રાખી પોતાને લગતી વિગતો મુજબ જ ઉમેદવારે ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ઓન લાઈન અરજીમાં દર્શાવેલ વિગતો અને ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજુ થનાર વિગતોમાં વિસંગતતા માલુમ પડશે તો અરજી અમાન્ય રાખવાનો બોર્ડને અબાધિત અધિકાર રહેશે.

ક્રમ નં	જગ્યાનું નામ	કુલ જગ્યાઓ	કક્ષાવાર જગ્યાઓ				કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ				કુલ જગ્યાઓ પૈકી અનામત
			બિન અનામત (સામાન્ય)	અનુ. જાતિ	અનુ. જન જાતિ	સા.શૈ.પ.વ.	બિન અનામત (સામાન્ય)	અનુ. જાતિ	અનુ. જન જાતિ	સા.શૈ. પ.વ.	
૧	વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨	૦૪	૦૧	૦૦	૦૧	૦૨	૦૦	૦૦	૦૦	૦૦	૦૦
૨	મદદનીશ પર્યાવરણ ઈજનેર (વર્ગ-૨)	૫૩	૨૭	૦૪	૧૦	૧૨	૦૮	૦૧	૦૩	૦૩	૦૩
૩	જુનીયર અધિકારી (વર્ગ-૨)	૦૩	૦૩	૦૦	૦૦	૦૦	૦૧	૦૦	૦૦	૦૦	૦૦
૪	જન સંપર્ક અધિકારી (વર્ગ-૨)	૦૧	૦૧	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦	૦૦

૫	સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ (વર્ગ-૩)	૩૪	૧૮	૦૨	૦૫	૦૯	૦૬	૦૦	૦૧	૦૩	૦૧
૬	સિનિયર ક્લાર્ક (વર્ગ-૩)	૦૬	૦૫	૦૦	૦૦	૦૧	૦૧	૦૦	૦૦	૦૦	૦૦

નોંધ:- (૧) અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જ અનામત છે.

(૨) ઉપરની જગ્યાઓ પૈકી નીચે દર્શાવેલ સંવર્ગોની જગ્યાઓ માટે નીચે દર્શાવ્યા મુજબની શારીરિક અશક્તતા ધરાવનાર ઉમેદવારો જ અરજી કરવાપાત્ર છે.

- I) મદદનીશ પર્યાવરણ ઈજનેર સંવર્ગમાં (૧) અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ૧ (એક) જગ્યા (૨) શ્રવણની ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ૧ (એક) જગ્યા અને (૩) હલનચલનની અશક્તતા અથવા મગજના લકવાની અશક્તતાવાળા ઉમેદવારો માટે ૧ (એક) જગ્યા અનામત છે. હલન ચલનની અશક્તતા અંતર્ગત OA ( One arm ), OL ( One leg), OAL (One arm and One leg), BL (Both legs) કેટેગરીના અશક્ત ઉમેદવારોને વિચારણામાં લેવામાં આવશે.
- II) સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ સંવર્ગમાં અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ૧ (એક) જગ્યા અનામત છે.
- III) ઉક્ત બંને સંવર્ગોમાં અંધત્વ અને ઓછી દ્રષ્ટિની અશક્તતા ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ થશે નહિ અથવા ઓછા ઉપલબ્ધ થશે તો તેટલી ખુટતી જગ્યાઓ અનુક્રમે શ્રવણની અશક્તતાવાળા ઉમેદવારોથી અને શ્રવણની અશક્તતાવાળા ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો હલન ચલનની અશક્તતા અથવા મગજના લકવાની અશક્તતા ધરાવતા હશે તેવા ઉમેદવારોથી તેમની યોગ્યતાને આધિન ભરવામાં આવશે.
- IV) સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ સંવર્ગમાં અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની અશક્તતા ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો અનુક્રમે શ્રવણની ૪૦% થી વધુ અને ૧૦૦% સુધીની અશક્તતા ધરાવતા અને હલન ચલનની અશક્તતા અંતર્ગત OA ( One arm ), OL ( One leg), OAL (One arm and One leg), BL (Both legs) કેટેગરીના અશક્ત ઉમેદવારોને વિચારણામાં લેવામાં આવશે.

- v) શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારને સામાન્ય વહીવટ વિભાગના તા. ૦૧/૧૨/૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક: ૧૦૨૦૦૮/૪૬૯૫૪૦-ગ-૨ થી નિયત થયેલ સક્ષમ સત્તાધિકારીના તબીબી પ્રમાણપત્રને આધીન રહીને ઉપલી વયમર્યાદામાં ૧૦ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
- vi) ઉપરના બંને સંવર્ગ સિવાય બાકીની જાહેરાતમાં દર્શાવેલ સંવર્ગ માટે શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે અને જગ્યાની ફરજને અનુરૂપ અશક્તતા યોગ્ય જણાશે તો વિચારણામાં લેવામાં આવશે.
- vii) શારીરિક અશક્તતા ધરાવતા પસંદ થયેલા ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે. શારીરિક અશક્તતા ધરાવતા લાયક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા જે તે કેટેગરીના અન્ય લાયક ઉમેદવારથી ભરવામાં આવશે.
- viii) સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ , વર્ગ- ૩ની કુલ ભરવાપાત્ર જગ્યાઓના ૧૦% જગ્યાઓ માજી સૈનિક ઉમેદવારો માટે અનામત છે. માજી સૈનિક કેટેગરીમાં પસંદ થયેલા ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી (બિનઅનામત, અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.અને શૈ.પ.વર્ગ ) સામે સરભર કરવામાં આવશે. માજી સૈનિક માટેની અનામત જગ્યાઓ માટે જો લાયક માજી સૈનિક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા જે તે કેટેગરીના અન્ય લાયક ઉમેદવારથી ભરવામાં આવશે.
- (૧) જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધ - ઘટ થવાની શક્યતાઓ છે. જે બાબતનો બોર્ડનો નિર્ણય આખરી રહેશે.
- (૨) ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર તથા અન્ય વિગતો : -

• **જગ્યા ક્રમાંક : ૧ : વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ - ૨**

• પગાર ધોરણ : - ( રૂ. ૯૩૦૦ - ૩૪૮૦૦ ) (પીબી- ૨) (ગ્રેડ પે રૂ. ૫૪૦૦/-) (છઠ્ઠા પગારધોરણ મુજબ)

• ઉંમર/ શૈક્ષણિક લાયકાત :

ઉમેદવાર : - અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ;

- I. ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૭ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- II. રાજ્ય/ કેન્દ્ર સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી વિજ્ઞાન શાખાના એન્વાયરમેન્ટલ સાયન્સ/ કેમેસ્ટ્રી/ બાયોકેમેસ્ટ્રી/ માઇક્રોબાયોલોજી/ એકવેટીક/ બાયોલોજી/ મરીન બાયોલોજી/ બાયો સાયન્સ/ બાયો ટેકનોલોજી/ એગ્રોનોમી/ ફીઝીકલ વીથ ઇન્સ્ટ્રુમેન્ટેશનના વિષય સાથે અનુસ્નાતકની પદવી.
- III. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ અને તેના વખતોવખતના સુધારા પ્રમાણે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
- IV. ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

V. અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદનો પર્યાવરણ વ્યવસ્થાપન અને પ્રદૂષણ નિયંત્રણને સ્પર્શતા સંલગ્ન વિવિધ પાસાઓનો ઓછામાં ઓછો ૫(પાંચ) વર્ષનો અનુભવ આવશ્યક છે.

• જગ્યા ક્રમાંક : ૨ : મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ - ૨

- પગાર ધોરણ : - ( રૂ. ૯૩૦૦ - ૩૪૮૦૦ ) (પીબી- ૨) (ગ્રેડ પે રૂ. ૪૬૦૦/-) (છઠ્ઠા પગારધોરણ મુજબ)
- ઉંમર/ શૈક્ષણિક લાયકાત :

ઉમેદવાર : - અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ;

- I. ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- II. રાજ્ય/ કેન્દ્ર સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાં પ્રથમ વર્ગમાં એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ / સિવિલ એન્જીનીયરીંગ શાખામાં વૈકલ્પિક એન્વાયરમેન્ટલ વિષય સાથે / કેમિકલ એન્જીનીયરીંગ શાખામાં વૈકલ્પિક એન્વાયરમેન્ટલ વિષય સાથે સ્નાતકની પદવી.
- III. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ અને તેના વખતોવખતના સુધારા પ્રમાણે કોમ્પ્યુટર નું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
- IX. ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

• જગ્યા ક્રમાંક : ૩ : જુનીયર અધિકારી, વર્ગ - ૨

- પગાર ધોરણ : - ( રૂ. ૯૩૦૦ - ૩૪૮૦૦ ) (પીબી- ૨) (ગ્રેડ પે રૂ. ૪૬૦૦/-) (છઠ્ઠા પગારધોરણ મુજબ)
- ઉંમર/ શૈક્ષણિક લાયકાત : -

ઉમેદવાર : - અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ;

- I. ઉંમર ૨૧ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ
- II. રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી કે સંસ્થાની આર્ટ્સ/સાયન્સ/કોમર્સ /બીઝનેસ એડમીનીસ્ટ્રેશન માં પ્રથમ વર્ગ સાથે અનુસ્નાતકની પદવી.
- III. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ અને તેના વખતોવખતના સુધારા પ્રમાણે કોમ્પ્યુટર નું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
- IV. ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે
- V. અનુસ્નાતક ની પદવી મેળવ્યા બાદનો રાજ્ય/કેન્દ્ર સરકાર/બોર્ડ કોર્પોરેશન/ લોકલ બોડી ખાતેનો વહીવટી કામકાજને સંલગ્ન વિવિધ પાસાઓનો / કામગીરીનો ઓછામાં ઓછો ૩ (ત્રણ ) વર્ષનો અનુભવ આવશ્યક છે.

• જગ્યા ક્રમાંક : ૪ : જન સંપર્ક અધિકારી, વર્ગ- ૨

• પગાર ધોરણ : ( રૂ. ૯૩૦૦ – ૩૪૮૦૦ ) (પીબી- ૨) ગ્રેડ પે રૂ. ૫૪૦૦/-)(છઠ્ઠા પગારધોરણ મુજબ)

• ઉંમર / શૈક્ષણિક લાયકાત :

ઉમેદવાર :- અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ;

- I. ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- II. માન્ય યુનિવર્સિટીની જર્નાલીઝમ (પત્રકારત્વ) ની સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ.
- III. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ અને તેના વખતોવખતના સુધારા પ્રમાણે કોમ્પ્યુટર નું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
- IV. ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે
- V. સ્નાતકની પદવી મેળવ્યા બાદનો આ જગ્યા માટેનો જુદા જુદા ક્ષેત્રોનો જાહેર સંપર્કની કામગીરી (Public Relation Work)નો ઓછામાં ઓછો ૩ (ત્રણ) વર્ષનો અનુભવ આવશ્યક છે.

• જગ્યા ક્રમાંક : ૫ : સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ - ૩

• પગાર ધોરણ : ( રૂ. ૯૩૦૦ – ૩૪૮૦૦ ) ( પીબી- ૨) ગ્રેડ પે રૂ. ૪૪૦૦/- (છઠ્ઠા પગારધોરણ મુજબ) ( પ્રથમ પાંચ વર્ષ માટે નાણા વિભાગના તા. ૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંક : ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ-૧ મુજબ ફીક્સ પગાર રૂ. ૩૮,૦૯૦/- ના માસિક ફીક્સ વેતનથી નાણાં વિભાગના તા. ૨૮/૦૩/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક : ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ-૧ મુજબની શરતો અને બોલીઓને આધિન નિમણુંક આપવામાં આવશે. ઉમેદવારે પાંચ વર્ષની સંતોષકારક સેવા પુર્ણ કર્યાની ખાત્રી થયેથી ઉપરોક્ત ઠરાવની જોગવાઈને આધિન રૂ. ૯૩૦૦ – ૩૪૮૦૦ પે બેન્ડ, ગ્રેડ પે રૂ. ૪૪૦૦/- (છઠ્ઠા પગારધોરણ મુજબ)ના પગારધોરણમાં નિયમિત નિમણુંક મેળવવાપાત્ર થશે. તેમ છતાં આ બાબતે નામદાર સર્વોચ્ચ અદાલતમાં દાખલ થયેલ SLP No.14124/2012 અને SLP No.14125/2012 ના ચૂકાદાને આધિન રહેશે.

• ઉંમર / શૈક્ષણિક લાયકાત :

ઉમેદવાર : - અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ;

- I. ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- II. રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એન્વાયરમેન્ટલ સાયન્સ /કેમેસ્ટ્રી/બાયો કેમેસ્ટ્રી /માઇક્રોબાયોલોજી/ એક્વેટીક બાયોલોજી/ મરીન બાયોલોજી/ બાયો સાયન્સ / બાયો ટેકનોલોજી /એગ્રોનોમી/ફીઝીક્સ વીથ ઇન્સ્ટ્રુમેન્ટેશનના વિષય સાથે અનુસ્નાતકની પદવી.

એન્વાયરમેન્ટલ સાયન્સ/ કેમેસ્ટ્રી/બાયો કેમેસ્ટ્રી/માઈક્રોબાયોલોજી વિષય સાથે અનુસ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારને તે ક્રમ અનુસાર પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.

- III. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ અને તેના વખતોવખતના સુધારા પ્રમાણે કોમ્પ્યુટર નું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
- IV. ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

● જગ્યા ક્રમાંક : ૬ : સિનિયર ક્લાર્ક, વર્ગ - ૩

- પગાર ધોરણ : ( રૂ. ૫૨૦૦- ૨૦૨૦૦ ) ( પીબી- ૧) ગ્રેડ પે રૂ. ૨૪૦૦/- (છઠ્ઠા પગારધોરણ મુજબ) (પ્રથમ પાંચ વર્ષ માટે નાંણા વિભાગના તા. ૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંક : ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ-૧ મુજબ ફીક્સ પગાર રૂ. ૧૬,૨૨૪/- ના માસિક ફીક્સ વેતનથી નાણાં વિભાગના તા. ૨૮/૦૩/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક : ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ-૧ મુજબની શરતો અને બોલીઓને આધિન નિમણુંક આપવામાં આવશે. ઉમેદવારે પાંચ વર્ષની સંતોષકારક સેવા પુર્ણ કર્યાની ખાત્રી થયેથી ઉપરોક્ત ઠરાવની જોગવાઈને આધિન રૂ. ૫૨૦૦ - ૨૦૨૦૦ પે બેન્ડ, ગ્રેડ પે રૂ. ૨૪૦૦/- (છઠ્ઠા પગારધોરણ મુજબ)ના પગારધોરણમાં નિયમિત નિમણુંક મેળવવાપાત્ર થશે. તેમ છતાં આ બાબતે નામદાર સર્વોચ્ચ અદાલતમાં દાખલ થયેલ SLP No.14124/2012 અને SLP No.14125/2012 ના ચૂકાદાને આધિન રહેશે.

● ઉંમર / શૈક્ષણિક લાયકાત :

ઉમેદવાર :- અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ;

- I. ઉંમર ૨૧ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- II. રાજ્ય/કેન્દ્ર સરકાર ધ્વારા માન્ય યુનિવર્સિટી કે સંસ્થાની કોમર્સ/આર્ટ્સ/કાયદા/બીઝનેસ એડમીનીસ્ટ્રેશન માં પ્રથમ વર્ગ સાથે સ્નાતકની પદવી આવશ્યક
- III. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ અને તેના વખતોવખતના સુધારા પ્રમાણે કોમ્પ્યુટર નું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
- III. ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે

જાહેરાતની સામાન્ય શરતો :-

૧. જરૂરી લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી રદ કરવામાં આવશે.
૨. જ્યારે યુનિવર્સિટી દ્વારા ટકાવારી આપવામાં ન આવતી હોય તો માક્સને ટકાવારીમાં બદલવા અંગેના માન્ય યુનિવર્સિટી કે સંસ્થા દ્વારા પ્રમાણિત સુત્રો ઉમેદવારે રજૂ કરવાના રહેશે.
૩. ક્રમાંક : ૧ થી ૪ માટે ઉમેદવારોની ઇન્ટરવ્યુ માટેની પસંદગી યાદી માટે પ્રાથમિક લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને લેખીત પરીક્ષાની તારીખની જાણ નિયત સમયગાળામાં કરવામાં આવશે. ઉમેદવારોએ

વખતોવખત બોર્ડની વેબસાઇટ જોતા રહેવાની સલાહ આપવામાં આવે છે. આ જાહેરાત માટે પસંદગી આ સાથે દર્શાવેલ વિગતો અનુસાર રહેશે.

૪. ગુજરાત સરકારશ્રીના ઠરાવ નં. PRC-102015-1223-K, તારીખ 06-11-2015 મુજબ સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ- ૩ અને સિનિયર ક્લાર્ક, વર્ગ-૩ની જગ્યાઓ માટે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના આધારે આખરી પસંદગી કરવામાં આવશે.
૫. પસંદગી પામેલા ઉમેદવારોને બોર્ડની ગુજરાત રાજ્યમાં આવેલી કોઈપણ કચેરીમાં બોર્ડની જરૂરીયાત મુજબ નિમણૂક આપવામાં આવશે. અને ભવિષ્યમાં બદલીને પાત્ર પણ રહેશે.
૬. પોતે આખરી પસંદગીમાં સમાવિષ્ટ થવા માત્રથી સંબંધિત જગ્યા ઉપર નિમણૂક મેળવવાનો દાવો કરવાને હક્કદાર થશે નહીં. નિમણૂક કરનાર સત્તાધિકારીને એવી ખાતરી થાય કે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ૧૯૬૭ થી ઠરાવેલ નિયમોનુસાર અને આ જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો અનુસાર યોગ્ય જણાતો નથી. તો તે તબક્કે આ ઉમેદવારને નિમણૂક ન આપવાનો નિર્ણય કરી શકશે અને આ બાબતે નિમણૂક સત્તાધિકારીનો નિર્ણય આખરી ગણાશે.
૭. આ ભરતી પ્રક્રિયા સંબંધિત જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો, ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ૧૯૬૭ ની જોગવાઈઓને આધિન રહેશે.
૮. આ જાહેરાત કોઈપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની કે જગ્યાઓની સંખ્યામાં વધ-ઘટ કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો બોર્ડને સંપુર્ણ હક્ક/અધિકાર રહેશે. અને આ માટે બોર્ડ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. તેમજ આવા સંજોગોમાં ભરેલ અરજી અને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે નહીં.
૯. રાષ્ટ્રીયતા : ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ૧૯૬૭ ના નિયમ-૭ ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ.

૭. જન્મ તારીખ અને વય મર્યાદા :-

(૧) ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ સુધીની ગણવામાં આવશે. જન્મ તારીખના પુરાવા માટે એસ.એસ.સી, બોર્ડ ધ્વારા આપેલ પ્રમાણપત્ર જ માન્ય ગણાશે. અરજીપત્રકમાં દર્શાવેલ જન્મ તારીખમાં પાછળથી કોઈપણ કારણસર ફેરફાર થઈ શકશે નહિ.

(૨) જાહેરાતમાં ઉપલી વય મર્યાદા આપવામાં આવેલ છે. તેમાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર છે.

૧	મુળ ગુજરાતના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો (જાહેરાતમાં જે અનામત વર્ગની જગ્યાઓ હશે તે અનામત વર્ગના ઉમેદવારોને જ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે).	પાંચ વર્ષ
૨	બિનઅનામત મહિલા ઉમેદવારો	પાંચ વર્ષ
૩	મુળ ગુજરાતના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના	દશ વર્ષ

	મહિલા ઉમેદવારો (જાહેરાતમાં જે અનામત વર્ગની જગ્યાઓ હશે તે અનામત વર્ગના ઉમેદવારોને જ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.	
૪	બિનઅનામત તથા અનામત વર્ગોના મહિલા ઉમેદવારો	બધી જ મળવાપાત્ર છૂટછાટ ગણતરીમાં લીધા બાદ વધુમાં વધુ ૪૫ વર્ષની ઉંમર સુધીજ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે
૫	ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કર્મચારીઓ	ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેઠળની જગ્યા ઉપર ફરજો બજાવતા બોર્ડના કર્મચારીઓને નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
૬	ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ	ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ,૧૯૬૭ની જોગવાઈ મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
૭	શારીરિક અશક્ત ઉમેદવાર	દશ વર્ષ (વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદામાં)
૮	માજી સૈનિક	માજી સૈનિકો અને ઈસીઓ/એસ.એસ.સી.ઓ સહિત લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત બીજા ત્રણ વર્ષ ઉમેરતા વધુમાં વધુ ૪૦ વર્ષની ઉંમર સુધીજ છૂટછાટ જાહેરાત ક્રમાંક: ૧ થી ૪ માટે છૂટછાટ મળવાપાત્ર થશે. જાહેરાત ક્રમાંક: ૫ અને ૬ માં માજી સૈનિક સળંગ છ માસથી ઓછી નહીં તેટલી ફરજ બજાવેલ હોય અને નોકરીમાંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તેવા માજી સૈનિકને તેમણે બજાવેલ ફરજનો સમયગાળો તેમની ઉંમરમાંથી બાદ કરતાં તેઓની ઉંમર, જાહેરાતમાં ઠરાવેલ ઉપલી વય મર્યાદા થી ત્રણ વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.

#### ૮. શૈક્ષણિક લાયકાત :-

- (૧) ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ધરાવતા હોવા જોઈએ.
- (૨) ઉમેદવારે જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ શૈક્ષણિક લાયકાતો,ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાએ કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ માન્ય યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એક્ટ- ૧૯૫૬ ની કલમ-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ.



- (૩) બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે ઉમેદવારે અરજી સાથે માન્ય યુનિવર્સિટી/સંસ્થાના ગુણ પત્રક (બધા જ વર્ષો/સેમેસ્ટર) અને પદવી પ્રમાણપત્રોની અસલ તેમજ સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
- (૪) શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી તેવો ઉમેદવારનો હક્ક દાવો સ્વીકારવામાં આવશે નહીં.
- (૫) જાહેરાતમાં દર્શાવેલ લાયકાત સમકક્ષ શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ધરાવે છે તેવો તેમનો હક્ક દાવો હોય તો આવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો/અધિકૃતતાની વિગતો આપવાની રહેશે.
- (૬) જે કિસ્સામાં ઉમેદવારના ગુણ પર્સન્ટાઇલમાં હોય તે પર્સન્ટેજના રૂપાંતર કરી અરજી ફોર્મમાં દર્શાવવાના રહેશે.
- (૭) (૧) ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૮/૨૦૦૮ તથા તા.૧૮/૩/૨૦૧૬ના ઠરાવ નંબર :સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-૫ મુજબ કોમ્પ્યુટરના બેઝીક નોલેજનું કોઇપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઇશે. વિકલ્પે (૨) કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવી લાયકાત સરકાર માન્ય યુનિ. અથવા સંસ્થામાંથી મેળવેલ હોવાના પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇશે. અથવા (૩) ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે.

ઓનલાઇન અરજી કરવાના તબક્કે આવું પ્રમાણપત્ર ધરાવતા ના હોય તો પણ અરજી કરી શકાશે. પરંતુ નિમણૂક મેળવતાં પહેલાં ઉમેદવારે આવું પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે. અન્યથા આવા ઉમેદવાર નિમણૂક મેળવવાપાત્ર ઠરશે નહીં.

#### ૯. અનુભવ.

- (૧) શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછીથી પૂર્ણ સમયનો અનુભવ,અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીનો ગણવામાં આવશે. જરૂરી શૈક્ષણિક લાયકાત પહેલાંનો અનુભવ ધ્યાને લેવામાં આવશે નહીં.
- (૨) ઉમેદવારે અરજીમાં જે અનુભવ દર્શાવેલ હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો (દિવસ,માસ,વર્ષ) મૂળ પગાર અને કુલ પગારની વિગતો તથા બજાવેલ ફરજોનો પ્રકાર/મેળવેલ અનુભવની વિગતો સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આવું પ્રમાણપત્ર સંસ્થાના લેટરપેડ પર સક્ષમ સત્તાધિકારની સહી અને તારીખ સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત પછીના અનુભવના પ્રમાણપત્ર તથા પ્રથમ પગાર સ્લીપ અને છેલ્લી પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે. અલગ-અલગ સંસ્થામાં અનુભવના કિસ્સામાં તે સંસ્થામાં જોડાયાની પ્રથમ પગારની સ્લીપ અને છેલ્લા પગારની સ્લીપ ક્રમાનુસાર તબક્કાવાર રજૂ કરવાની રહેશે.
- (૩) ઉમેદવારે રજૂ કરેલ અનુભવના પ્રમાણપત્રમાં પાછળથી કોઇ ફેરફાર કરવાની વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં. અરજી કર્યા પછી અનુભવના નવા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં.
- (૪) અંશકાલીન રોજીદા વેતનદાર, એપ્રેન્ટીસશીપ, તાલીમી, માનદ વેતન, આમંત્રિત ફેકલ્ટી તરીકે ઉમેદવારે મેળવેલ અનુભવ માન્ય અનુભવ તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહીં.
- (૫) પાર્ટ ટાઇમનો અનુભવ ધ્યાને લેવામાં આવશે નહીં.

#### ૧૦. જાતિ પ્રમાણપત્ર

- (૧) મૂળ ગુજરાતના જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મળશે.

- (૨) અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, પૈકી ઉમેદવારે જે વર્ગના હોય તેની વિગતો અરજીપત્રમાં અચુક આપવી. જાતિમાં ફેરફાર અંગેની પાછળથી કરવામાં આવેલ વિનંતી માન્ય રાખવામાં આવશે નહિ.
- (૩) ઉમેદવારે અરજીપત્રકના સંબંધિત કોલમમાં જે તે અનામત કક્ષા દર્શાવેલ નહીં હોય તો પાછળથી અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મેળવવાનો હક્ક દાવો માન્ય રાખવામાં આવશે નહિ.
- (૪) અનામત વર્ગનો લાભ મેળવવા ઇચ્છતા ઉમેદવારે તેના સમર્થનમાં સક્ષમ અધિકારી ધ્વારા નિયત નમુનામાં આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્રની નકલ બોર્ડ અરજી મંગાવે ત્યારે અરજી સાથે અચુક સામેલ કરવાની રહેશે. અરજીપત્રક સાથે જાતિ પ્રમાણપત્રની નકલ સામેલ નહીં હોય તો તે પાછળથી સ્વીકારવામાં આવશે નહીં અને અરજીપત્રક રદ થવાને પાત્ર બનશે.
- (૫) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ અનામતનો લાભ જો તેઓનો સમાવેશ ઉન્નત વર્ગમાં નહીં થતો હોય તો જ મળવાપાત્ર થશે.
- (૬) (અ) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૦૬-૦૨-૧૯૯૬ ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ (ક) મુજબનું અથવા ઉક્ત વિભાગના તા.૨૭/૪/૨૦૧૦ના ઠરાવથી નિયત કરાયેલ ગુજરાતી નમૂના પરિશિષ્ટ-૪ મુજબનું રજૂ કરવાનું રહેશે.
- (બ) તા. ૧/૪/૨૦૧૬ના રોજ કે ત્યાર બાદ ઇસ્યુ થયેલ ઉન્નતવર્ગમાં સમાવેશ ન થવા અંગેના પ્રમાણપત્રની અવધી ઇસ્યુ થવા વર્ષ સહિત ત્રણ વર્ષની રહેશે. પરંતુ આવું પ્રમાણપત્ર જાહેરાત માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરાયેલ હોવું જોઈશે.
- (ક) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મહિલા પરિણિત ઉમેદવારે તેમના પિતાની આવકના આધારે મેળવેલ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતા હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારે તેમના પતિની આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કર્યું હશે તો તેમની અરજી રદ ગણવામાં આવશે.
- (ડ) અરજી સાથે પરિશિષ્ટ- ક અથવા પરિશિષ્ટ-૪ ના બદલે Annexure – A (અંગ્રેજીમાં) રજૂ કરેલ હશે તો પણ અરજી રદ કરવામાં આવશે. કેમ કે, Annexure – A ભારત સરકારશ્રી હેઠળની રોજગારી માટે આપવામાં આવે છે. અરજી સાથે પરિશિષ્ટ-ક અથવા પરિશિષ્ટ-૪ રજૂ નહીં કરેલ હોય તો અરજી રદ કરવામાં આવશે. અરજી બિન અનામત કક્ષા માટે પણ વિચારણામાં લેવામાં આવશે નહીં.
- (ઇ) ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા છ માપદંડો ધ્યાને લેવાય છે. પ્રમાણપત્રની અવધિ હવે ત્રણ વર્ષની છે. પરંતુ આ માપદંડો પૈકી કોઈપણ માપદંડમાં આ અવધિ દરમ્યાન ફેરફાર થાય તો તેની સ્વૈચ્છિક જાહેરાત સંબંધિત ઉમેદવારે તથા તેના માતા-પિતા/વાલીએ સ્વયં સંબંધિત સત્તાધિકારી તેમજ તેના ધ્વારા પ્રમાણપત્રમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તેની જાણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવાની રહેશે. ઉમેદવાર/માતા-પિતા/ વાલી આવી જાહેરાત નહીં કરીને કોઈ વિગતો છૂપાવશે તો તેઓ કાયદેસરની કાર્યવાહીને પાત્ર બનશે અને તેઓએ મેળવેલ અનામતનો લાભ રદ ઠરાવવાપાત્ર થશે. ઉન્નતવર્ગમાં સમાવેશ નહીં થવા અંગેના પ્રમાણપત્ર મેળવવા માટેના કોઈપણ માપદંડમાં ફેરફારની સ્વૈચ્છિક જાહેરાત કરવાની જવાબદારી ઉમેદવાર/ માતા-પિતા/ વાલીની વ્યક્તિગત રીતે અને સંયુક્ત રીતે રહેશે.

(એફ) ઉમેદવારે ઓનલાઇન અરજી કરતી વખતે જે "ઉન્નત" વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેના પ્રમાણપત્રની વિગતો જણાવેલ હોય તેની જ નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે. જો આવાં પ્રમાણપત્રમાં કોઈ ભૂલ હોવાના કારણે ઉમેદવાર જાહેરાતની છેલ્લી તારીખ બાદનું નવું પ્રમાણપત્ર મેળવે તો પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના ઉમેદવાર તરીકે પાત્ર થવા માટે ઓનલાઇન અરજીમાં જણાવેલ પ્રમાણપત્ર જ માન્ય રહેશે.

- (૭) સરકારની પ્રવર્તમાન જોગવાઈ મુજબ અનામત કક્ષાના ઉમેદવારો બિનઅનામત વર્ગના ઉમેદવારોની સાથે નિયત ધોરણો (અર્થાત વયમર્યાદા, અનુભવની લાયકાત, બિનઅનામતવર્ગના ઉમેદવારો માટે અપનાવેલ હોય તેના કરતાં વધુ વિસ્તૃત કરેલ અન્ય ક્ષેત્ર) માં છૂટછાટ લીધા સિવાય પોતાની ગુણવત્તાના આધારે પસંદગી પામે તો બિનઅનામત જગ્યાની સામે ગણતરીમાં લેવાના થાય છે.
- (૮) અરજી કરતી વખતે ઉન્નત વર્ગમાં સમાવેશ ના થતો હોવા અંગેનું નિયત સમયગાળાનું અને નિયત નમુનાનું પ્રમાણપત્ર ધરાવતા ન હોય તેવા ઉમેદવારોને બિન અનામત ઉમેદવાર તરીકે અરજી કરવા સલાહ આપવામાં આવે છે અને તેવા ઉમેદવારોને બિન અનામતની શરતો લાગુ પડશે.
- (૯) ઉમેદવારે અરજીમાં જાતિ અંગે જે વિગત દર્શાવેલ હશે તેમાં પાછળથી ફેરફાર કરવાની વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં.
- (૧૦) વિધવા મહિલા ઉમેદવાર:

(અ) સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે તેમને સ્પર્ધાત્મક / પ્રાથમિક લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના ૫ % ગુણ તેમજ રૂબરૂ મુલાકાતમાં મેળવેલ ગુણના ૫% લેખે થતા ગુણ ઉમેરી આપવામાં આવશે. પરંતુ તેઓએ ભરતી પ્રક્રિયા અને નિમણુંક સમયે પુનઃ લગ્ન કરેલ ન હોવા જોઈએ. વિધવા ઉમેદવાર તરીકે લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ નથી તેવી એફીડેવિટ રજૂ કરવાની રહેશે.

(બ) કોઈપણ મહિલા ઉમેદવાર જાહેરાત માટે અરજી કરે તે સમયે વિધવા ન હોય પરંતુ અરજી કર્યા બાદ અથવા જાહેરાત પ્રસિધ્ધ થવાની છેલ્લી તારીખ બાદ અથવા ભરતી પ્રક્રિયાના કોઈપણ તબક્કે "વિધવા" બને અને તે અંગે જરૂરી દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કરે તો તેની રજૂઆત મળ્યા તારીખ પછીના ભરતી પ્રક્રિયાના જે તબક્કા બાકી હોય તે તબક્કાથી જ તેવા મહિલા ઉમેદવારને "વિધવા મહિલા ઉમેદવાર" તરીકેના લાભ આપવામાં આવશે.

- (૧૧) મહિલા ઉમેદવાર : - સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૫/૧૯૯૭ના ઠરાવ ક્રમાંક:સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩-ગ-૨ મુજબ મહિલાઓ માટેની અનામત જગ્યાઓ માટે જો યોગ્ય મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા જે તે કક્ષાના (category) પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે.

- (૧૨) જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી.આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી માટે વિચારણા થઈ શકે છે. પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. (દા.ત.કુલ ૧૦ જગ્યાઓ પૈકી ૦૩ જગ્યાઓ મહિલા ઉમેદવાર માટે અનામત છે. પરંતુ બાકી રહેતી ૦૭ જગ્યાઓ સામે મહિલા ઉમેદવાર પસંદગી પામી શકે છે.)

(૧૩) શારીરિક અશક્ત ઉમેદવાર : -

- (ક) શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રકમાં વિગતો આપવાની રહેશે.
- (ખ) શારીરિક અશક્તતા ૪૦% કે તેથી વધુ હોય તેવા ઉમેદવારને જ શારીરિક અશક્તતાનો લાભ મળવાપાત્ર રહેશે. શારીરિક અશક્તતાનો લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારે (૧) અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ (૨) શ્રવણની ખામી (૩) હલનચલનની અશક્તતા અથવા મગજનો લકવો તે પૈકીની કઈ શારીરિક અશક્તતા છે તે અરજીપત્રકમાં દર્શાવવું.
- (ગ) જાહેરાતમાં શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે અનામત જગ્યા દર્શાવેલ ન હોય, પરંતુ જગ્યાની ફરજોને અનુરૂપ જે પ્રકારની શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને પાત્ર ગણેલ હોય તેઓ તે જાહેરાત માટે અરજી કરી શકશે. આવા પ્રસંગે ઉપલી વયમર્યાદામાં નિયમ મુજબ મળવાપાત્ર છૂટછાટ મળશે.
- (ઘ) શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારે તેના સમર્થનમાં સામાન્ય વહીવટ વિભાગના તા. ૦૧/૧૨/૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક: ૧૦૨૦૦૮/૪૬૯૫૪૦-ગ-૨ થી નિયત થયેલ નમુનામાં સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ/સિવિલ સર્જન/મેડીકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રની નકલ અરજી સાથે અચુક મોકલવાની રહેશે. જો પ્રમાણપત્રની નકલ સામેલ કરવામાં નહીં આવેલ હોય તો તે પાછળથી સ્વિકારવામાં આવશે નહીં. શારીરિક અશક્તતા ઉમેદવાર તરીકેનો લાભ મળવાપાત્ર થશે નહીં.

૧૪) માજી સૈનિક :-

- (૧) માજી સૈનિક ઉમેદવારોએ અરજીપત્રકમાં વિગતો આપવાની રહેશે.
- (૨) માજી સૈનિક ઉમેદવારે ડિસ્ચાર્જ બુકની નકલ બોર્ડ ધ્વારા જણાવવામાં આવે ત્યારે અચુક રજુ કરવાની રહેશે.

- (૧૫) રમતગમતના ગુણ : (૧) સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩ તથા સિનિયર ક્લાર્ક, વર્ગ-૩ની જગ્યા માટે જ:  
એથલેટિક્સ (ટ્રેક અને ફીલ્ડ રમતો સહિત), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમીંગ, ટેબલટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેઇટલિફ્ટીંગ, રેસલિંગ, બોક્સીંગ, સાયકલીંગ, જીમનેસ્ટીક્સ, જૂડો, રાઇફલ શૂટિંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડ બોલની રમતો - ખેલક્રમમાં (૧) રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય અથવા (૨) આંતરયુનિવર્સિટી અથવા (૩) અખિલ ભારતીય શાળા સંઘ ધ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે તેમને મેળવેલ કુલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે. તેથી ઉપરની ત્રણ સ્તરની સ્પર્ધાઓમાં ઉમેદવારોએ ભાગ લીધેલ હોય તેવા જ ઉમેદવારોએ અરજીપત્રકમાં જરૂરી વિગતો દર્શાવવાની રહેશે. આ ત્રણ સ્તર સિવાયની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હોય તો તેને અગ્રીમતા માટે માન્ય ગણવાની રહેતી ન હોવાથી તેવા ઉમેદવારોએ અરજીપત્રકમાં વિગતો દર્શાવવાની રહેશે નહીં. ઉક્ત ત્રણ સ્તરની સ્પર્ધામાં ભાગ લીધેલ ઉમેદવારોએ સરકારના તા. ૨૫/૨/૧૯૮૦ ઠરાવ નંબર સીઆરઆર/૧૦૭૭/૨૬૬૦/ગ-૨ તથા તા.૧/૮/૧૯૯૦ના ઠરાવ નંબર:સીઆરઆર/૧૧૮૮/૩૬૪૪-ગ-૨ માં નિયત કર્યા મુજબના સત્તાધિકારી પાસેથી નિયત નમૂનામાં

જરૂરી પ્રમાણપત્ર અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાનાં રહેશે. આવું પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવાર જ રમતના ગુણ મેળવવા હકકદાર થશે. (૨) રમતગમતના ગુણ બાકીની જાહેરાતમાં મળવાપાત્ર નથી.

(૧૬) “નાં” વાંધાં પ્રમાણપત્ર :-

(૧) ગુજરાત સરકારના સરકારી/અર્ધ સરકારી/ સરકાર હસ્તકના કોર્પોરેશન/ કંપનીઓમાં સેવા બજાવતા અધિકારી/કર્મચારીઓ બોર્ડની જાહેરાતના સંદર્ભમાં બારોબાર અરજી કરી શકશે. અને તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ/ખાતા/કચેરીને અરજી કર્યાની તારીખથી દિન - ૭ માં અચુક કરવાની રહેશે. જો ઉમેદવારના નિયોક્તા (નોકરીદાતા) તરફથી અરજી મોકલવાની છેલ્લી તારીખ બાદ ૩૦ દિવસમાં અરજી કરવાની પરવાનગી નહીં આપવાની જાણ કરવામાં આવશે, તો તેઓની અરજી નામંજૂર કરી ઉમેદવારી રદ કરવામાં આવશે.

(૨) કેન્દ્ર સરકારની અથવા અન્ય કોઈપણ રાજ્ય સરકારના અર્ધ સરકારી/ સરકાર હસ્તકના બોર્ડ-કોર્પોરેશન /કંપની માં નોકરીમાં હોય તેવા ઉમેદવારે રૂબરૂ મુલાકાત વખતે સક્ષમ અધિકારીનું અસલ “નાં” વાંધા પ્રમાણપત્ર” તેમજ સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.

(૩) જાહેરાત ક્રમાંક : ૫ અને ૬ ઉપરની જગ્યા વર્ગ- ૩ ની હોઈ, બોર્ડ ધ્વારા ઉમેદવાર પાસેથી જ્યારે પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવે તે સમયે ઉમેદવારે સક્ષમ અધિકારી ધ્વારા આપવામાં આવેલ અસલ “ના વાંધા પ્રમાણપત્ર “ તેમજ સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.

(૧૭) ગેરલાયક ઉમેદવાર :-

ગુજરાત જાહેર સેવા આયોગ કે અન્ય જાહેર સેવા આયોગ અથવા અન્ય સરકારી/અર્ધ સરકારી/ સરકાર હસ્તકની સંસ્થાઓ ધ્વારા ઉમેદવાર ક્યારેય પણ ગેરલાયક ઠરાવેલ હોય તો તેની વિગત અરજીપત્રકમાં આપવાની રહેશે. જો ઉમેદવારનો ગેરલાયકનો સમય ચાલુ હશે તો આવા ઉમેદવારની અરજી રદ થવાને પાત્ર રહેશે.

(૧૮) ફરજિયાત નિવૃત્તિ, રૂખસદ, બરતરફ :-

અગાઉ ઉમેદવારને સરકારી સેવા /સરકાર હસ્તકની કંપની કે બોર્ડ કોર્પોરેશનમાંથી ક્યારેય પણ ફરજિયાત નિવૃત્તિ, રૂખસદ કે બરતરફ કરવામાં આવેલ હોય તો અરજીપત્રકમાં તેની વિગત આપવાની રહેશે.

(૧૯) અરજી તથા અરજી ફી :-

(૧) એક ઉમેદવાર એકજ અરજી કરી શકશે. તેમ છતાં એકથી વધુ અરજીના કિસ્સામાં ફી સહિત સર્વ રીતે યોગ્ય રીતે ભરેલી અરજીઓ પૈકી સૌથી છેલ્લી કન્ડર્મ થયેલી (સૌથી ઉંચા નંબરની) એકજ અરજી માન્ય રહેશે. તે સિવાયની બધી અરજીઓ રદ થશે.

(૨) એક કરતાં વધારે અરજી કરવામાં આવશે તો ફી ભરેલી છેલ્લી અરજી સાથેની ફીને, ફી નહીં ભરેલી અરજી સામે ગણવામાં આવશે નહીં.

- (૩) સામાન્ય કેટેગરીના પુરૂષ ઉમેદવારે પોસ્ટ ઓફીસમાં રૂ. ૨૦૦/- પરીક્ષા ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ રૂ. ૧૨/- ભરવાનો રહેશે. અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે.
- (૪) મુળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારોએ અને તમામ મહિલા ઉમેદવારોએ પોસ્ટ ઓફીસમાં રૂ. ૧૦૦/- પરીક્ષા ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ રૂ. ૧૨/- ભરવાનો રહેશે. અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે.
- (૫) ઉમેદવારો વેબસાઈટ ઉપર અરજી સબમીટ કરે ત્યારે તેઓને ફી ભરવા માટે ઓનલાઈન ચલણની ત્રણ નકલોની એક પાના ઉપર પ્રિન્ટ મેળવવાની સુચના મળશે. ઉમેદવારોએ આ પાનાની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
- (૬) ઉમેદવારોએ ચલણ સાથે કોઈપણ કોમ્પ્યુટરાઈઝડ પોસ્ટ ઓફીસમાં નિયત ફી ભરવાની રહેશે. પોસ્ટ ઓફીસમાં ફી ભર્યાની છેલ્લી તારીખ ૧૦/૧૧/૨૦૧૭ સુધીમાં ફી ભરેલ હોવી આવશ્યક છે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં ફી સ્વીકારી શકાશે નહીં. નાણાં ભર્યાની પહોંચ (ચલન) સાચવી રાખવાની રહેશે
- (૭) ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર છે. ફી ભરેલ નહીં હોય તેવા ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં/ પ્રાથમિક કસોટીમાં બેસવા દેવામાં આવશે નહીં. આ ફી ફક્ત પોસ્ટ ઓફીસ ધ્વારા જ સ્વીકારવામાં આવશે. રોકડમાં , ડીમાન્ડ ડ્રાફ્ટથી, ઈન્ડિયન પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડરના સ્વરૂપમાં સ્વીકારવામાં આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
- (૮) ભરેલી ફી કોઈપણ સંજોગોમાં પરત મળી શકશે નહિ.
- (૨૦) ઉમેદવારોને ખાસ જણાવવાનું કે, અરજીપત્રક તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર, આ જગ્યાના ભરતી નિયમો, તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતા નથી તેમ માલુમ પડશે તો તેમની ઉમેદવારી કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે.
- (૨૧) નીચે દર્શાવ્યા મુજબની અરજીઓ રદ કરવામાં આવશે. (આ યાદી માત્ર ઉદાહરણ સ્વરૂપે છે. જે સંપૂર્ણ નથી)
- (૧) ઓનલાઈન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય
- (૨) અરજીમાં દર્શાવેલ વિગતો અધુરી કે અસંગત હોય
- (૩) અરજીમાં ઉમેદવારે સહી કે પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરેલ ન હોય
- (૪) અરજી ફેક્સ થી ઈ-મેઈલથી અથવા પોસ્ટથી મોકલાવેલ હોય
- (૫) ઉમેદવારે નિયત ફી ન ભરેલ હોય
- (૬) અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવાર તેઓની કેટેગરી અંગેનું પ્રમાણપત્ર ધરાવતા ન હોય
- (૭) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ સમયગાળાનું ઉચ્ચત વર્ગમાં સમાવેશ થતો ના હોવા અંગેનું નોન કિમીલીયર પ્રમાણપત્ર ધરાવતા ન હોય.

(૨૨) બોર્ડ જે કોઈ ઉમેદવારને :

- (૧) તેને ઉમેદવારી માટે કોઈપણ પ્રકારે ટેકો મેળવવા માટે એટલે કે બોર્ડના અધ્યક્ષ, સભ્ય અથવા કોઈ અધિકારી પર પ્રત્યક્ષ કે પરોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા માટે;
- (૨) બીજાનું નામ ધારણ કરવા માટે ;
- (૩) બીજા પાસે પોતાનું નામ ધારણ કરાવવા માટે;
- (૪) બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીતી આચરવા માટે;
- (૫) યથાર્થ અથવા ખોટા અથવા મહત્વની માહિતી છુપાવતા હોય તેવા નિવેદનો કરવા માટે;
- (૬) પરીક્ષા માટે તેની ઉમેદવારીના સંબંધમાં અન્ય કોઈ અનિયમિત અથવા અયોગ્ય સાધનનો આશ્રય લેવા માટે;
- (૭) પરીક્ષા દરમ્યાન ગેરવ્યાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે એટલે કે અન્ય ઉમેદવારની ઉત્તરવહીમાંથી નકલ કરવા, પુસ્તક, ગાઈડ, કાપલી કે તેવા કોઈપણ છાપેલા કે હસ્તલિખિત સાહિત્યની મદદથી અથવા વાતચીત દ્વારા નકલ કરવા કે ઉમેદવારને નકલ કરાવવાની ગેરરીતીઓ પૈકી કોઈપણ ગેરરીતી આચરવા માટે;
- (૮) લખાણોમાં અશ્લિલ ભાષા અથવા બિભત્સ બાબત સહિતની અપ્રસ્તુત બાબત લખવા માટે;
- (૯) OMR (ઉત્તરપત્ર) માં પોતાની ઓળખસુચક કોઈપણ પ્રકારની નિશાની, લખાણ, આલ્ફાબેટ, ચિન્હ, કે જેનાથી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસ કરવા માટે;
- (૧૦) પરીક્ષા ખંડમાં અન્ય કોઈ રીતે ગેરવર્તણુંક કરવા માટે;
- (૧૧) પરીક્ષાના સંચાલન કરવા માટે બોર્ડ રોકેલા સ્ટાફને સીધી કે આડકતરી રીતે હેરાન કરવા અથવા શારીરિક રીતે ઈજા કરવા માટે;
- (૧૨) પુર્વવર્તી ખંડોમાં નિર્દિષ્ટ કરેલા તમામ અથવા કોઈપણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટે અથવા આવા પ્રસંગે મદદગીરી કરવા માટે; અથવા
- (૧૩) પરીક્ષા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશપત્રમાં આપવામાં આવેલી કોઈપણ સુચનાનો ભંગ કરવા માટે દોષિત ઠર્યા હોય તો અથવા દોષિત હોવાનું જાહેર કર્યું હોય તો તે ફોજદારી કાર્યવાહી પાત્ર થવા ઉપરાંત (ક) બોર્ડ તે જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાંથી ગેરલાયક ઠરાવી શકશે. અથવા (ખ) (૧) બોર્ડ સીધી પસંદગી માટે લેવાની કોઈપણ પરીક્ષામાં બેસવામાંથી અથવા કોઈપણ રૂબરૂ મુલાકાતમાંથી, અથવા (૨) બોર્ડ, પોતાના જ હેઠળની કોઈપણ નોકરીમાંથી કાયમી રીતે અથવા નિર્દિષ્ટ મુદત માટે ગેરલાયક/બાકાત કરી શકશે.
- (૧૪) ગુજરાત જાહેર સેવા આયોગ કે અન્ય જાહેર સેવા આયોગ અથવા અન્ય સરકારી/અર્ધસરકારી/સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા ઉમેદવાર ક્યારેય પણ ગેરલાયક ઠરાવેલ હોય અને ગેરલાયકાતનો સમય ચાલુ હશે તો આવા ઉમેદવારની અરજી આપોઆપ રદ થવાને પાત્ર બનશે.

## ભરતી હેઠળની જગ્યાઓ માટેની પસંદગી પ્રક્રિયા

### જાહેરાત ક્રમાંક : ૧ થી ૪

- (૧) આ જગ્યાની નિમણૂક માટે સીધી ભરતીથી પસંદગીની પ્રક્રિયા અનુસરવાની થાય છે. જો જગ્યાના પ્રમાણમાં મળેલ અરજીની ચકાસણી બાદ સીધે સીધી રૂબરૂ મુલાકાત યોજી શકાય તેમ જણાશે તો તે જાહેરાત માટે સીધે સીધી રૂબરૂ મુલાકાત લેવામાં આવશે. આવા કેસમાં રૂબરૂ મુલાકાત ૧૦૦ ગુણની રહેશે અને ફરરા (૪) માં દર્શાવેલ લઘુત્તમ ગુણનું ધોરણ રહેશે. જ્યાં જગ્યાના પ્રમાણમાં વધુ અરજી મળશે તો ઉમેદવારોની પસંદગી પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાત યોજીને કરવામાં આવશે. પ્રાથમિક કસોટીના ગુણ ક્રમાંનુસાર જરૂરી અરજીઓની ચકાસણી કરી ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા નક્કી કરાશે. આ કસોટીનું માધ્યમ બોર્ડ અન્યથા નક્કી કરશે નહીં તો ગુજરાતી રહેશે. પ્રાથમિક કસોટી સામાન્યતઃ અમદાવાદ/ગાંધીનગર ખાતે લેવામાં આવશે. અને ઉમેદવારોએ સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
- (૨) પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ગણવામાં આવશે. રૂબરૂ મુલાકાત માટે બોલાવવાના થતાં ઉમેદવારોમાં, જો કોઈ ઉમેદવારના પ્રાથમિક કસોટીના પરિણામને આધારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવાના થતા ઉમેદવારોમાં સમાવેશ થતો હોય તેવા ઉમેદવારોને ૧૦% કે તેથી ઓછા ગુણ મેળવેલ હશે તો રૂબરૂ મુલાકાત માટે પાત્રતા નક્કી કરવા, અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદીમાં વિચારણામાં લેવામાં આવશે નહીં.
- (૩) પ્રાથમિક કસોટીમાં સામાન્ય અભ્યાસના ૧૦૦ ગુણના ૧૦૦ પ્રશ્નો અને સંબંધિત વિષયના ૨૦૦ ગુણના ૨૦૦ પ્રશ્નો રહેશે. પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે.
- (૪) ઉમેદવારોની આખરી પસંદગી ૫૦ ટકા ગુણભાર પ્રાથમિક કસોટીના ૩૦૦ ગુણમાંથી મેળવેલ ગુણ અને ૫૦ ટકા ગુણભાર રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. એટલે કે પ્રાથમિક કસોટીમાં ૩૦૦ ગુણમાંથી મેળવેલ ગુણને ૫૦ ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતમાં ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણને ૫૦ ટકા ગુણભાર ગણી કુલ ૧૦૦ ગુણમાંથી ગુણ આપવામાં આવશે.



## સ્પષ્ટીકરણ :-

જો ઉમેદવારે પ્રાથમિક કસોટીમાં ૩૦૦ ગુણમાંથી ૧૫૦ ગુણ મેળવેલ હશે અને રૂબરૂ મુલાકાતમાં ૧૦૦ ગુણમાંથી ૬૦ ગુણ મેળવશે તો લેખિત પ્રાથમિક કસોટીના ૫૦ ટકા ગુણભાર મુજબ ૨૫ ગુણ અને રૂબરૂ મુલાકાતના ૫૦ ટકા ગુણભાર મુજબ ૩૦ ગુણ એમ કુલ ૫૫ ગુણ થશે. પ્રાથમિક કસોટી/ અને રૂબરૂ મુલાકાતના કુલ: ૧૦૦ ગુણમાંથી પસંદગી માટેનું લાયકી ધોરણ બિન અનામત વર્ગ અને અનામત વર્ગના ઉમેદવારો માટે નીચે મુજબ રાખવામાં આવે છે:-

ક્રમ	વર્ગ (Category)	સામાન્ય જગ્યા	(મહિલા)
૧	બિન અનામત(સામાન્ય) વર્ગ	૫૦	૪૫
૨	સા.શૈ.પ.વર્ગ	૩૫	૩૧
૩	અનુ.જાતિ	૩૫	૩૧
૪	અનુ.જનજાતિ	૩૫	૩૧

- (૫) સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૫/૧૯૯૭ના ઠરાવ મુજબ મેરીટના ધોરણે પસંદ થયેલ મહિલા ઉમેદવારોની ગણતરી મહિલાઓ માટેની અનામત જગ્યા સામે ગણવામાં આવશે.
- (૬) જે જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત હશે અને જે તે કેટેગરીની સામાન્ય જગ્યા માટે માટે નિયત થયેલ લઘુત્તમ ગુણ મેળવતા પૂરતી સંખ્યામાં મહિલા ઉમેદવારો ન મળે ત્યારે મહિલા ઉમેદવાર માટે નિયત થયેલ પસંદગીનું લાયકીધોરણ લાગુ પડશે. જે જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત નથી ત્યાં સામાન્ય જગ્યાનું લાયકીધોરણ મહિલા ઉમેદવારોને પણ લાગુ પડશે.
- (૭) પ્રાથમિક કસોટીમાં ઉમેદવારને O.M.R. Sheet માં જવાબ આપવા માટે A, B, C, D અને E એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ E 'Not attended' તરીકેનો રહેશે. જો ઉમેદવારે તમામ વિકલ્પો ખાલી રાખ્યા હોય (encode કર્યા ન હોય) અથવા ખોટા જવાબ આપેલ હોય અથવા એકથી વધુ વિકલ્પો એનકોડ કરેલ હોય ત્યારે જે તે જવાબના નિશ્ચિત ગુણના ૦.૨૫ ટકા ગુણ Negative Marks મેળવેલ માર્ક્સમાંથી કાપવામાં આવશે. અને જો પાંચમો વિકલ્પ E'Not attended' એનકોડ કરેલ હોય તો "શૂન્ય" ગુણ કાપવાના રહેશે. અર્થાત માત્ર E'Not attended' વિકલ્પ જ encode કર્યો હશે તો તે પ્રશ્ન માટે કોઈ નેગેટીવ ગુણ કાપવામાં આવશે નહીં.

(૮) જાહેરાતમાં દર્શાવેલ કેટેગરીવાર જગ્યાની સંખ્યાને ધ્યાને લઈ, નીચે મુજબ ધોરણ અનુસરવામાં આવશે.

કુલ જગ્યાઓની સંખ્યા	રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવનાર ઉમેદવારોની સંખ્યા
૦૧	૦૬
૦૨	૦૮
૦૩	૧૦
૦૪ કે તેથી વધુ	કુલ જગ્યાઓથી ૦૩ ગણા

આ ગણતરી દરેક કેટેગરી માટે અલગ અલગ રહેશે.

- (૯) ઉપર દર્શાવેલ સંખ્યાની ગણતરી સમયે છેલ્લા ક્રમના ઉમેદવાર જેટલા ગુણ ત્યાર પછીના ગુણ ક્રમનુસાર જે ઉમેદવારો ધરાવતા હોય તો તેઓની રૂબરૂ મુલાકાત માટે વિચારણા કરવામાં આવશે અને તેઓ લાયકાત ધરાવતા હશે તો રૂબરૂ મુલાકાતને પાત્ર થશે. પરિણામે તેટલી સંખ્યા વધવા પામશે.
- (૧૦) પ્રાથમિક કસોટીના વિકલ્પે જાહેરાતમાં ઠરાવેલ લઘુત્તમ લાયકાત તેમજ અનુભવ કરતાં વધુ શૈક્ષણિક લાયકાત અને/ અથવા વધુ અનુભવ અને/ અથવા લાયકાતમાં ઉંચી ટકાવારીને આધારે રૂબરૂ મુલાકાત માટે બોર્ડ ઉમેદવારોની સંખ્યા મર્યાદિત કરી શકશે.
- (૧૧) માજી સૈનિકો તથા શારીરિક અશક્ત ઉમેદવારોની જગ્યાઓ અનામત હોય ત્યારે સંબંધિત કેટેગરીના માજી સૈનિકો તથા શારીરિક અશક્ત ઉમેદવારો પૈકી જે ઉમેદવારો આ પ્રમાણેના લઘુત્તમ ગુણ મેળવતા હશે તેમને સંબંધિત કેટેગરીની અનામત જગ્યા સામે ગણવામાં આવશે. જો જાહેરાતમાં જણાવ્યા પ્રમાણેની આ કેટેગરીઓ માટે રાખવામાં આવેલ અનામત જગ્યાઓ માટે આ લઘુત્તમ ગુણ મેળવતા ઉમેદવારો પ્રાપ્ત ન થાય કે પુરતી સંખ્યામાં પ્રાપ્ત ન થાય તો સંબંધિત કેટેગરીના લઘુત્તમ ગુણના ૧૦ % ધોરણ હળવું કરીને પસંદગી કરવામાં આવશે.

## રૂબરૂ મુલાકાત:-

રૂબરૂ મુલાકાતના દિવસે ઉમેદવારે રૂબરૂ મુલાકાતના પત્રમાં દર્શાવવામાં આવેલ અસલ પ્રમાણપત્રો રજૂ કરવાનાં રહેશે. જો ઉમેદવાર અસલ પ્રમાણપત્ર રજૂ કરશે નહીં તો તેઓ રૂબરૂ મુલાકાત માટે પાત્ર બનશે નહીં તેની ખાસ નોંધ લેવી.

## જાહેરાત ક્રમાંક : ૫ થી ૬

જાહેરાત ક્રમાંક : ૫ સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ , વર્ગ- ૩ તથા જાહેરાત ક્રમાંક : ૬ સિનિયર કલાર્ક, વર્ગ-૩ની જગ્યા માટે માત્ર લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષાની તારીખની જાણ નિયત સમયગાળામાં કરવામાં આવશે. ઉમેદવારોએ વખતોવખત બોર્ડની વેબસાઇટ જોતા રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના આધારે પસંદગી યાદી/પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. પસંદગી માટે બિન અનામત વર્ગના ઉમેદવારે કુલ ગુણના ૪૦% લઘુત્તમ અને અનામત વર્ગના ઉમેદવારે ૩૫% થી ઓછા ગુણ મેળવેલ હશે તો પસંદગી માટે વિચારણાપાત્ર થશે નહીં. આ બંને જાહેરાતો માટેની પરીક્ષા યોજના આ સાથે સામેલ છે.

## પ્રતીક્ષાયાદી:-

- (૧) જાહેરાત ક્રમાંક: ૧ થી ૪માં સમાવિષ્ટ સંવર્ગો પર પસંદગી માટે જે ગુણ નિયત કરવામાં આવેલ છે તે ગુણ ધરાવતા ઉમેદવારો જે તે કેટેગરીની જગ્યાઓ કરતાં વધુ પ્રાપ્ત થશે તો, પસંદગીયાદીમાં સમાવેશ થયા બાદ બાકી રહેલા ઉમેદવારોનો ગુણ ક્રમાનુસાર પ્રતીક્ષાયાદીમાં સમાવેશ કરવામાં આવશે.
- (૨) જાહેરાત ક્રમાંક: ૫ થી ૬ માટે જાહેરાતમાં દર્શાવેલ કક્ષાવાર જગ્યાઓની સંખ્યાના ૨૦% જગ્યાઓની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. પરંતુ જાહેરાતની સંખ્યાના પ્રમાણમાં જરૂર જણાય તો તે પ્રમાણે પ્રતીક્ષાયાદી તૈયાર કરવાની બોર્ડને સત્તા રહેશે.
- (૩) પ્રતીક્ષાયાદી પરથી નિમણૂક આપવા તથા તેની સમય મર્યાદા માટે સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓ લાગુ પડશે.
- (૪) પ્રતીક્ષાયાદીએ પસંદગી યાદી નથી. આથી પ્રતીક્ષાયાદીમાં સમાવેશ થયેલ હોવાના કારણે કોઈ ઉમેદવાર નિમણૂક મેળવવા હકકદાર રહેશે નહીં.

## Online અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત:-

આ જાહેરાતના સંદર્ભમાં બોર્ડ ધ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તા.૧૬/૧૦/૨૦૧૭ (૧૩.૦૦ કલાક) થી ૧૦/૧૧/૨૦૧૭ (૧૩.૦૦ કલાક) દરમિયાન : <https://ojas.gujarat.gov.in> પર અરજી પત્રક ભરી શકશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના Steps (૧) થી (૧૫) અનુસરવાના રહેશે. Confirmation Number મળ્યા પછી જ અરજી માન્ય ગણાશે.

(૧) સૌ પ્રથમ : <https://ojas.gujarat.gov.in> પર જવું.

(૨) Apply On line Click કરવું.

આ પ્રમાણે click કરવાથી (૧) More Details તથા (૨) Apply Now બટન દેખાશે. સૌપ્રથમ More Details પર click કરીને જાહેરાતની બધી જ વિગતોનો અભ્યાસ ઉમેદવારોએ કરવો અને ત્યાર બાદ Apply Now બટન ક્લિક કરવું.

(૩) જગ્યાની વિગતો મળશે

(૪) તેની નીચે Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ "Personal Details" ઉમેદવારે ભરવી. (અહીં લાલ કુદરડી(\*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.) Personal Details માં જ્યાં Mobile Number અને email ID માંગ્યા છે તેની વિગત લખવી જેથી જરૂર જણાયે બોર્ડ ઉમેદવારને માહિતગાર કરી શકે.

(૫) Personal Details ભરાયા બાદ Educational Details ભરવા માટે Educational Details પર ક્લિક કરવું અને પોતાની શૈક્ષણિક વિગતો ભરવી.

(૬) Additional Qualification પર ક્લિક કરી Additional Qualification કરવી.

(૭) Experience Details પર ક્લિક કરવું અને Experience Details ભરવી. વધુ Experience ઉમેરવા માગતા હોય તો Add. પર ક્લિક કરી Details ભરવી.

(૮) Additional Information પર ક્લિક કરી ત્યાં માહિતી ભરવી. જે વધારાનો અનુભવ Ojas module માં સમાવિષ્ટ ન થતો હોય,તો સાદા કાગળ પર Ojas માં જણાવ્યા મુજબના અનુભવના કોઠા પ્રમાણે આપે વધારાના અનુભવની વિગત ઉમેરીને મોકલવી.

- (૯) તેની નીચે "Self-Declaration" માં Yes/No પર click કરવું.
- (૧૦) હવે Save પર click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે અને હવે પછી આ જાહેરાતના સંદર્ભમાં બોર્ડ સાથેના કોઇ પણ પત્ર વ્યવહારમાં તે દર્શાવવાનો રહેશે.
- (૧૧) જો આપની અરજીપત્રકમાં કોઇ સુધારા-વધારા કરવાના હોય તો Edit Application માં જઇને કરી શકાશે. આ સુવિધા અરજી Confirm કરતાં પહેલાં ઉપલબ્ધ છે. એક વખત અરજી Confirm થઇ ગયા પછી/ બાદ આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
- (૧૨) હવે પેજના ઉપરના ભાગમાં upload photo પર click કરો અહીં તમારો Application Number type કરો અને તમારી Birth date type કરો. ત્યાર બાદ Ok પર click કરો. અહીં photo અને signature upload કરવાના છે. (ફોટાનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. પહોળાઇ અને signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.) photo અને signature upload કરવા સૌ પ્રથમ તમારો photo અને signature jpg Format માં (૧૦Kb) સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ.) "Browse Button પર click કરો હવે choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં .jpg Format માં તમારો photo Store થયેલ છે તે ફાઇલને ત્યાંથી Select કરો અને "open Button ને click કરો. હવે "Browse Button"ની બાજુમાં Upload પર click કરો હવે બાજુમાં તમારો photo દેખાશે. હવે આજ રીતે signature પણ upload કરવાની રહેશે.
- (૧૩) હવે પેજના ઉપરના ભાગમાં "Confirm Application" પર click કરો અને "Application Number" તથા Birth date Type કર્યા બાદ ok પર click કરવાથી બે (૨) બટન ૧: Application Preview ૨: Confirm Application દેખાશે. ઉમેદવારે "Application Preview" પર ક્લિક કરી પોતાની અરજી જોઇ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application પર ક્લિક કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઇપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઇ ગયા બાદ અરજીમાં કોઇપણ સુધારો થઇ શકશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર ક્લિક કરવું. Confirm Application પર ક્લિક કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં Online સ્વીકાર થઇ જશે. અહીં "Confirmation number" generate થશે જે હવે પછી બધીજ કાર્યવાહી માટે જરૂરી હોઇ, ઉમેદવારે સાચવવાનો રહેશે. "Confirmation number" સિવાય કોઇપણ પત્રવ્યવહાર કરી શકાશે નહીં. Confirm થયેલ અરજી પત્રકની પ્રિન્ટ અચૂક કાઢી રાખવી.

(૧૪) ઉમેદવારે ભરવાની થતી ફી નીચે મુજબ ભરી શકશે.

પોસ્ટ ઓફીસમાં : "Print Challan" ઉપર કલિક કરીને પ્રિન્ટેડ ચલણની નકલ કાઢવાની રહેશે. આ પ્રિન્ટેડ ચલણની નકલ લઈને નજીકની કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટ આફીસમાં જવાનું રહેશે. પોસ્ટ ઓફીસમાં બિન અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા ૨૦૦/- તથા અનામત વર્ગના અને મહિલા ઉમેદવારોએ રૂ.૧૦૦/- બોર્ડની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ રૂપિયા ૧૨/- તારીખ ૧૦/૧૧/૨૦૧૭ સુધીમાં ભરવાની રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. આ ચલણ તથા confirm થયેલ અરજીપત્રક સાથે જોડવાના આવશ્યક સ્વયં પ્રમાણિત કરેલ પ્રમાણપત્રો (૧) જન્મ તારીખના પુરાવા માટે એસ.એસ.સી. કેડીટ સર્ટિફિકેટની નકલ (૨) નિયત શૈ.લા. ના ડીગ્રી પ્રમાણપત્રની નકલ અને ડીગ્રીના અંતિમ વર્ષની માર્કશીટની નકલ (૩) અનુભવના પ્રમાણપત્રની નકલ (૫) નામ/અટકમાં ફેરફાર કરાવેલ હોય તો સરકારી ગેઝેટની નકલ/ પરિણીત મહિલા ઉમેદવારે મેરેજ રજીસ્ટ્રેશનની નકલ (૬) શારીરિક રીતે અશક્ત ઉમેદવારે સા.વ.વિભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ ના પરિપત્રથી નિયત થયેલ નમુના મુજબનું પ્રમાણપત્ર (૭) અન્ય લાગુ પડતા હોય તેવા આધાર/પુરાવા અચુક જોડીને ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાના રહેશે અને બોર્ડ ધ્વારા માંગવામાં આવે ત્યારે જ અરજીપત્રક બિડાણો સહિત તથા ફી ભરેલા ચલણની નકલ સાથે આર.પી.એ.ડી./ સ્પીડ પોસ્ટથી મોકલવાના રહેશે અથવા બોર્ડની કચેરીમાં રૂબરૂમાં આપી જવાના રહેશે.

(કે.સી.મિસ્ત્રી)  
સભ્યસચિવ

પ્રાથમિક કસોટી  
અભ્યાસક્રમ (syllabus)

વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨

પ્રશ્નપત્ર-૧ : સામાન્ય જ્ઞાન : ૧૦૦ માર્ક  
માધ્યમ ગુજરાતી : સમય : ૬૦ મિનિટ : ૧૦૦ પ્રશ્નો(હેતુલક્ષી)

૧	ભારતની ભૂગોળ - ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો-ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૨	ભારતનો સાંસ્કૃતિક વારસો-સાહિત્ય, કલા અને સ્થાપત્યો- ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૩	ભારતનો ઇતિહાસ- ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૪	ભારતની અર્થવ્યવસ્થા
૫	ભારતીય નાગરિક શાસ્ત્ર (ક) ભારતનું બંધારણ (૧) આમુખ (૨) મૂળભૂત અધિકારો અને ફરજો (૩) માર્ગદર્શક સિધ્ધાંતો (૪) સંસદ, વિધાનસભા, (૫) ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ- કેન્દ્ર અને રાજ્યના (૬) ન્યાયતંત્ર (૭) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ (૮) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (૯) નાણાં પંચ (૧૦) એટર્ની જનરલ (ખ) બંધારણીય તથા વૈજ્ઞાનિક સંસ્થાઓ- ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય લોક સેવા આયોગ, કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ અને રાજ્ય માહિતી આયોગ
૬	સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી (General Mental Ability Test)
૭	સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
૮	રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો, ખેલ જગત સહિત

નોંધ:- ૧) પ્રશ્નપત્રનું સ્તર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૨ સુધીનું રહેશે.

૨) પ્રથમ પેપર પૂર્ણ થયા બાદ એક કલાકનો વિરામ રહેશે.

પ્રશ્નપત્ર - ૨

Science

૨૦૦૫૬

Medium : English

Duration : 120 minutes

: Questions: 200

(objective)

1	Environmental Chemistry
2	Environmental Ecology
3	Environmental Microbiology and Environmental Biotechnology
4	Pollution Control
5	Environment legislations, rules and policies
6	Environment Management System
7	Analytical Laboratory Techniques and Instrumentation

Note:- (1) The level of Question Paper shall be of graduate level of Universities of Gujarat



## પ્રાથમિક કસોટી

### અભ્યાસક્રમ (syllabus)

મદદનીશ પર્યાવરણ ઇજનેર, વર્ગ-૨

પ્રશ્નપત્ર-૧ : સામાન્ય જ્ઞાન : ૧૦૦ માર્ક  
માધ્યમ ગુજરાતી : સમય : ૬૦ મિનિટ : ૧૦૦ પ્રશ્નો(હેતુલક્ષી)

૧	ભારતની ભૂગોળ - ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો-ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૨	ભારતનો સાંસ્કૃતિક વારસો-સાહિત્ય, કલા અને સ્થાપત્યો- ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૩	ભારતનો ઇતિહાસ- ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૪	ભારતની અર્થવ્યવસ્થા
૫	ભારતીય નાગરિક શાસ્ત્ર (ક) ભારતનું બંધારણ (૧) આમુખ (૨) મૂળભૂત અધિકારો અને ફરજો (૩) માર્ગદર્શક સિધ્ધાંતો (૪) સંસદ, વિધાનસભા, (૫) ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ- કેન્દ્ર અને રાજ્યના (૬) ન્યાયતંત્ર (૭) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ (૮) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (૯) નાણાં પંચ (૧૦) એટર્ની જનરલ (ખ) બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ- ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય લોક સેવા આયોગ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ અને રાજ્ય માહિતી આયોગ
૬	સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી (General Mental Ability Test)
૭	સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
૮	રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો, ખેલ જગત સહિત

નોંધ:- ૧) પ્રશ્નપત્રનું સ્તર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૨ સુધીનું રહેશે.

૨) પ્રથમ પેપર પૂર્ણ થયા બાદ એક કલાકનો વિરામ રહેશે.

પ્રશ્નપત્ર-૨:

Environmental Engineering

૨00 Marks

Medium : English

Duration : 120 minutes

:

Questions: 200

(Objective)

૧	Types of pollution, pollutants and their impact on environment
૨	Solid, Hazardous, Bio medical waste and their management
૩	Environmental legislations and rules made their under
૪	Environment Management Systems, Pollution Control, Role of CPCB and GPCB
૫	Cleaner Production and Technology, Green Chemistry
૬	Environment Impact Assessment Audit and Life Cycle Assessment

Note:- (1) The level of Questions Paper-2 shall be of Graduate level of Universities of Gujarat

પ્રાથમિક કસોટી  
અભ્યાસક્રમ (syllabus)

**જુનિયર અધિકારી, વર્ગ-૨**

પ્રશ્નપત્ર-૧ : સામાન્ય જ્ઞાન : ૧૦૦ માર્ક  
માધ્યમ ગુજરાતી : સમય : ૬૦ મિનિટ : ૧૦૦ પ્રશ્નો (હેતુલક્ષી)

૧	ભારતની ભૂગોળ - ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો-ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૨	ભારતનો સાંસ્કૃતિક વારસો-સાહિત્ય, કલા અને સ્થાપત્યો- ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૩	ભારતનો ઇતિહાસ- ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૪	ભારતની અર્થવ્યવસ્થા
૫	ભારતીય નાગરિક શાસ્ત્ર (ક) ભારતનું બંધારણ (૧) આમુખ (૨) મૂળભૂત અધિકારો અને ફરજો (૩) માર્ગદર્શક સિધ્ધાંતો (૪) સંસદ, વિધાનસભા, (૫) ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ- કેન્દ્ર અને રાજ્યના (૬) ન્યાયતંત્ર (૭) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ (૮) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (૯) નાણાં પંચ (૧૦) એટર્ની જનરલ (ખ) બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ- ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય લોક સેવા આયોગ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ અને રાજ્ય માહિતી આયોગ
૬	સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી (General Mental Ability Test)
૭	સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
૮	રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો, ખેલ જગત સહિત

નોંધ:- ૧) પ્રશ્નપત્રનું સ્તર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૨ સુધીનું રહેશે.

૨) પ્રથમ પેપર પૂર્ણ થયા બાદ એક કલાકનો વિરામ રહેશે.

પ્રશ્નપત્ર-૨ :

ગુણ - ૨૦૦

માધ્યમ : ગુજરાતી : સમય : ૧૨૦ મિનિટ  
પ્રશ્નો : ૨૦૦ (હેતુલક્ષી)

૧	ગુજરાત રાજ્ય સેવા (નિયમો, ૨૦૦૨ (પગાર, રજા અને પેન્શનના વોલ્યુમ)
૨	ગુજરાત નાણાંકીય નિયમો, ૧૯૭૧
૩	ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, ૧૯૭૧
૪	ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧
૫	માહિતી (મેળવવાનો) અધિનિયમ, ૨૦૦૫
૬	ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ, ૨૦૧૩
૭	પ્રદૂષણનો ઉદ્ભવ અને તેને નિવારવાના ઉપાયો
૮	પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાર્યો, ફરજો / જવાબદારીઓ
૯	ગુજરાત આકસ્મિક ખર્ચના નિયમો
૧૦	રાજ્ય સરકારની ખરીદ નીતિ
૧૧	"ટેલી" હિસાબી પદ્ધતિ

પ્રાથમિક કસોટી  
અભ્યાસક્રમ (syllabus)

જનસંપર્ક અધિકારી, વર્ગ-૨

પ્રશ્નપત્ર-૧ : સામાન્ય જ્ઞાન : ૧૦૦ માર્ક  
માધ્યમ ગુજરાતી : સમય : ૬૦ મિનિટ : ૧૦૦ પ્રશ્નો(હેતુલક્ષી)

૧	ભારતની ભૂગોળ - ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો-ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૨	ભારતનો સાંસ્કૃતિક વારસો-સાહિત્ય, કલા અને સ્થાપત્યો- ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૩	ભારતનો ઇતિહાસ- ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૪	ભારતની અર્થવ્યવસ્થા
૫	ભારતીય નાગરિક શાસ્ત્ર (ક) ભારતનું બંધારણ (૧) આમુખ (૨) મૂળભૂત અધિકારો અને ફરજો (૩) માર્ગદર્શક સિધ્ધાંતો (૪) સંસદ, વિધાનસભા, (૫) ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ- કેન્દ્ર અને રાજ્યના (૬) ન્યાયતંત્ર (૭) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ (૮) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (૯) નાણાં પંચ (૧૦) એટર્ની જનરલ (ખ) બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ- ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય લોક સેવા આયોગ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ અને રાજ્ય માહિતી આયોગ
૬	સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી (General Mental Ability Test)
૭	સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
૮	રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો, ખેલ જગત સહિત

નોંધ:- ૧) પ્રશ્નપત્રનું સ્તર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૨ સુધીનું રહેશે.

૨) પ્રથમ પેપર પૂર્ણ થયા બાદ એક કલાકનો વિરામ રહેશે.

Paper-2      **JOURNALISM**

200 Marks

Medium : English    Duration : 120 minutes    :    Questions    :    200

(Objective)

1	Mass Communication- <ul style="list-style-type: none"><li>• What is Mass Communication ?</li><li>• Forms of Mass Communication ?</li><li>• Process and objectives of the Mass Communication?</li><li>• Form of Communication: Nature and process of human Communication/Verbal and Non-verbal, Intra-personal/Small Group - public and Mass Communication.</li></ul>
2	Data Management and Utilization <ul style="list-style-type: none"><li>• Storage system/Data archival and management/ Application of archived data/ Feedback mechanism and utilization of feedback data/web based publicity tools/Smart phone based publicity tools.</li></ul>
3	Script of advertisement, writing, layout, punch line
4	Communication through exhibition
5	Communication through publication <ul style="list-style-type: none"><li>• Book, Booklet, Pamphlet, Folders</li><li>• Preparation of Posters etc.</li></ul>
6	Right to Information Act - 2005
7	Duties & function of the State Pollution Control Board
8	Source of the pollution and Mitigation measures to control

Note:- (1) The level of Questions Paper Shall be of Graduate level of Universities of Gujarat

સ્પર્ધાત્મક પરીક્ષા  
અભ્યાસક્રમ (syllabus)

સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩

પ્રશ્નપત્ર-૧ : સામાન્ય જ્ઞાન : ૧૦૦ માર્ક  
માધ્યમ ગુજરાતી : સમય : ૬૦ મિનિટ : ૧૦૦ પ્રશ્નો(હેતુલક્ષી)

૧	ભારતની ભૂગોળ - ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો-ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૨	ભારતનો સાંસ્કૃતિક વારસો-સાહિત્ય, કલા અને સ્થાપત્યો- ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૩	ભારતનો ઇતિહાસ- ગુજરાતના ખાસ સંદર્ભ સહિત.
૪	ભારતની અર્થવ્યવસ્થા
૫	ભારતીય નાગરિક શાસ્ત્ર (ક) ભારતનું બંધારણ (૧) આમુખ (૨) મૂળભૂત અધિકારો અને ફરજો (૩) માર્ગદર્શક સિધ્ધાંતો (૪) સંસદ, વિધાનસભા, (૫) ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ- કેન્દ્ર અને રાજ્યના (૬) ન્યાયતંત્ર (૭) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ (૮) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (૯) નાણાં પંચ (૧૦) એટર્ની જનરલ  (ખ) બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ- ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય લોક સેવા આયોગ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કેન્દ્રીયસતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ અને રાજ્ય માહિતી આયોગ
૬	સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી (General Mental Ability Test)
૭	સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
૮	રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો, ખેલ જગત સહિત

નોંધ:- ૧) પ્રશ્નપત્રનું સ્તર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૨ સુધીનું રહેશે.

૨) પ્રથમ પેપર પૂર્ણ થયા બાદ એક કલાકનો વિરામ રહેશે.

પ્રશ્નપત્ર - ૨

Science

૨૦૦મિનિટ

Medium : English Duration : 120 minutes

: Questions: 200

(objective)

1	Environmental Chemistry
2	Environmental Ecology
3	Environmental Microbiology and Environmental Biotechnology
4	Pollution Control
5	Environmental legislations, rules and policies
6	Environmental Management System
7	Analytical Laboratory Techniques and Instrumentation

Note:- (1) The level of Question Paper shall be of under graduate level of Universities of Gujarat



**સ્પર્ધાત્મક પરીક્ષા**  
**અભ્યાસક્રમ (syllabus)**

સિનિયર કલાર્ક, વર્ગ-૩

સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (ભાગ-૧) ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) : ગુણ : ૨૦૦  
માધ્યમ : ગુજરાતી: સમય : ૧૨૦ મિનિટ : પ્રશ્નો : ૨૦૦(હેતુલક્ષી)

ક્રમ	વિષય
૧	સામાન્ય જ્ઞાન :ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, કલા અને સંસ્કૃતિ, ભારતનું બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો - ભારત અને ગુજરાત, કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન, પર્યાવરણ, જાહેર વહિવટ, સરકારી યોજનાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ.
૨	ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય
૩	અંગ્રેજી વ્યાકરણ
૪	ગાણિતિક અને તાર્કિક કસોટીઓ

નોંધ:-

(૧) પરીક્ષા Multiple Choice Question (MCQ) અને Optical Mark Reader (OMR) પદ્ધતિની રહેશે. (ii) દરેક પ્રશ્નનો ૦૧ (એક) ગુણ રહેશે. (iii) ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.(iv) ખોટા જવાબ દીઠ, એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલ જવાબદીઠ મેળવેલ ગુણમાંથી ૦.૨૫ ગુણ કમી કરવામાં આવશે. નેગેટીવ માર્કીંગ લાગુ પડશે.(v) દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ "E" "Not attempted" રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને "Not attempted" વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કીંગ લાગુ પડશે નહીં. (vi) પ્રશ્નના આપેલા બધા વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ નહીં કરવામાં આવે તો, મેળવેલ ગુણમાંથી ૦.૨૫ ગુણ કમી (નેગેટીવ માર્કીંગ) કરવામાં આવશે.

ભાગ : ૨ કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા ) કસોટી : ગુણ : ૧૦૦  
સમય :૧ કલાક ૩૦ મિનિટ

પ્રશ્ન ક્રમાંક	વિષયનું વિતરણ	ગુણ
૧	ગુજરાતી ટાઇપીંગ ટેસ્ટ	૩૦ ગુણ
૨	અંગ્રેજી ટાઇપીંગ ટેસ્ટ	૨૦ ગુણ
૩	કોમ્પ્યુટર પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર ટેસ્ટ- એપેન્ડીક્ષ - A	૫૦ ગુણ
	કુલ :	૧૦૦ ગુણ

એપેન્ડીક્ષ - A : પ્રેક્ટીકલ ટેસ્ટ

Sr.No	Particulars	Marks
1	Preparing a note in word file	10 Marks
2	Preparing a power point slide for presentation based on data provided	15 Marks
3	Preparing in excel spreadsheet and answering an arithmetic problem	15 Marks
4	E-mail (with attachments)	10 Marks
	Total	50 Marks

(૨) પેપર-૧ ના ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ દરેક કેટેગરીની ૦૧ જગ્યા સામે ૧૦ ઉમેદવારોને ભાગ-૨ની પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. આ સંખ્યાની ગણતરીમાં દસમાં ક્રમના ઉમેદવારના જેટલા ગુણ ત્યાર પછીના જે કોઈ ઉમેદવારના હશે અને જાહેરાતની જોગવાઈ સંતોષતા હશે તો ભાગ-૨ (પેપર-૨) માટે પાત્ર ગણાશે, પરિણામે તેટલી સંખ્યા વધવા પામશે.